https://archive.org/details/bk1393/page/n0/mode/1up

2011-09 -Patidar Saurabh (1393)

All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

સપ્ટેમ્બર - ૨૦૧૧

પાટીદાર સૌરભ


ત્રિવાર્ષિક લવાજમ રૂા.૩૦૦



માતાનામઢમાં
પાટીદાર ભવનનું
ઉદ્‌ઘાટન



દેશલપર (ગુંતલી)
લક્ષ્મીનારાયણ મંદિરનો
ભવ્ય
હિરક મહોત્સવ



કેન્દ્રીય સમાજ
સનાતની રંગે રંગાયુ....
પ્રમુખપદે ગંગારામભાઇ સાંખલા

realpatidar.com

https://archive.org/details/bk1393/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 2, 6.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1393/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.23 14:47:29 +05'30'



સપ્ટેમ્બર - ૨૦૧૧

પાટીદાર સૌરભ

ત્રિવાર્ષિક લવાજમ રૂા.૩૦૦

માતાનામઢમાં
પાટીદાર ભવનનું ઉદ્‌ઘાટન

દેશલપર (ગુંતલી)
લક્ષ્મીનારાયણ મંદિરનો
ભવ્ય
હિરક મહોત્સવ

**કેન્દ્રીય સમાજ
સનાતની રંગે રંગાયુ....
પ્રમુખપદે ગંગારામભાઇ સાંખલા**

realpatidar.com

https://archive.org/details/bk1393/page/n3/mode/1up


2011-09 -Patidar Saurabh (1393)

realpatidar.com

Result of Sanatani Revolution Movement

આખરે સનાતનીઓ પ[illegible]ંચ્યા

કેન્દ્રીય સમાજના નવા સુકાની બનતા દિલ્હીના ગંગારામભાઈ સાંખલા



કેન્દ્રીય સમાજના પ્રમુખપદે ગંગારામભાઈ સાંખલાનું નામ જાહેર કરાયું ત્યારે તેમના ચહેરા પર સનાતની હાસ્ય છલકાઈ ગયું હતું !

૧૪ ઓગસ્ટ, ૨૦૧૧ ! ભારતના ૬૫મા સ્વાતંત્ર્યદિની પૂર્વ સંધ્યાએ દેશભરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉન્માદ જગાવનાર અણ્ણા હઝારે પાટનગર દિલ્હીમાં તેમના અનશનની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણાના પ્રાંગણમાં પણ એક નવી જ આઝાદીનો ગુંજારવ સંભળાઈ રહ્યો હતો.

શ્રાવણના પવિત્ર મદમસ્ત માહોલમાં સવારથી જ પાટીદાર વિદ્યાર્થી ભવનનું પ્રાંગણ દેશભરમાંથી ઉમટી પડેલા સનાતનીઓની ચહલપહલથી ગુંજી ઉઠ્યું હતું. હવામાં એક અલગ જ પ્રકારનો ઉન્માદ, જોશ જોવા મળતો હતો. હવાની રૂખ પારખનારા અનુભવી વડીલોને નવા-જૂનીના એંધાણ મળી જ ગયાં હતા.

સમગ્ર સમાજ સાંપ્રદાયિક પ્રશ્ને હાલે જે કપરી પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો છે તેમાંથી વહેલી તકે મુક્તિ મેળવવા અને આમૂલ પરિવર્તનની આશા સાથે દેશના ૨૯ ઝોનમાંથી આવેલા જ્ઞાતિજનોનો એક જ અવાજ આવતો હતો...આ વખતે સંપૂર્ણ ક્રાંતિથી ઓછું કંઈ જ ન ખપે !

સુવર્ણ જયંતિ ઉજવી ગયેલા પાટીદાર વિદ્યાર્થી ભવને સમાજની અને કતડકી-છાંયડી જોઈ છે. આ ભવ્ય ઈમારતે ખીમજી માસ્તર અને મનજી વાલજી જેવા નિષ્ઠાવાન સમાજ સેવકોની દાગરહિત કાર્યપ્રણાલી જોઈ છે તો ક્ષુલ્લક સ્વાર્થ ખાતર સમાજના હિતોને વેચી નાખનારા પદાધિકારીઓના કરતૂતોનું પણ આ ભવન સાક્ષી રહ્યું છે !

પરંતુ આજે આ ભવન એક એવી ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવાનું હતું જેના માટે દેશભરના લાખો સનાતની પાટીદારો લાંબા સમયથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. જન્માષ્ટમી તહેવારોને લઈ બહારના ભાઈઓ વહેલા જ કચ્છમાં આવી ગયા હતા. ગામે ગામ યોજાતી મિટિંગોમાં પણ એક જ ચર્ચા સંભળાઈ રહી હતી કે ૧૪ ઓગસ્ટના શું થશે?

સતપંથ-સનાતન વિવાદને લઈ ઉભા થયેલ કેશોમાં જોઈન્ટ ચેરીટી કમિશ્નરનો હુકમ અને હાઈકોર્ટના આદેશને લઈ સામાન્ય સભા કઈ રીતે પાર પાડવી તેની ચિંતા વડીલો અને પદાધિકારીઓને સતાવી રહી હતી તો કાનૂન અને બંધારણની મર્યાદામાં રહીને સંપૂર્ણ 'સફાયો' કરી દેવા માટે સનાતનીઓ તલપાપડ થઈ રહ્યા હતા !

સનાતનીઓને છેલ્લા લાંબા સમયથી બે મોરચે લડવું પડે છે તેને લઈ સમગ્ર સમાજમાં જે આક્રોશ ફેલાયો હતો તેના પડઘા કેન્દ્રીય સમાજની સામાન્ય સભામાં પડ્યા વગર કઈ રીતે રહે? સમાજના

કેન્દ્રીય સમાજના હોદ્દેદારો

પ્રમુખ	:	શ્રી ગંગારામ હિરાલાલ સાંખલા	-	દિલ્હી
ઉપપ્રમુખ	:	શ્રી મનસુખ વિશ્રામ રૂડાણી	-	અમદાવાદ
ઉપપ્રમુખ	:	શ્રી દેવજી રામજી ભાવાણી	-	સુરત
મહામંત્રી	:	શ્રી માવજી કેશરા ભગત	-	ભુજ
મંત્રી	:	શ્રી વાલજી હીરજી ચૌહાણ	-	દહાણું રોડ
મંત્રી	:	શ્રી નરસિંહ નારાણ સાંખલા	-	અમદાવાદ
મંત્રી	:	શ્રી માવજી શામજી છાભૈયા	-	નખત્રાણા
ખજાનચી	:	શ્રી લાલજી હંસરાજ રામાણી	-	નખત્રાણા
સહખજાનચી	:	શ્રી ભગવાનભાઈ શામજી ધોળુ	-	નાગલપર
ઓડીટર	:	શ્રી અબજી વિશ્રામ કાનાણી	-	મુંબઈ
ઓડીટર	:	શ્રી ગંગારામ ભાણજી લીંબાણી	-	અમદાવાદ
ઓડીટર	:	શ્રી ડાહ્યાલાલ હીરજી રામાણી	-	અમદાવાદ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1393/page/n4/mode/1up

realpatidar.com



પંચ ત્યાં પરમેશ્વર : સામાન્ય સભાએ મૂકેલ વિશ્વાસને પંચોએ આ વખતે સાર્થક કર્યો. નહીં તો આપણે ત્યાં ભરોસાની ભેંસ પાડો જણવા માટે જાણીતી છે !

વર્તમાન માળખામાં રહી સતપંથીઓ કરતાં પણ વધુ નુકશાન કરતા મવાળવાદી તત્ત્વો સાથેનો હિસાબ ચૂકતે કરવા સમાજના આજીવન સભ્યો અભૂતપૂર્વ ઝનૂન સાથે ઉમટી પડ્યા હતા.

આમ તો, ગયા વર્ષે અધિવેશન વખતે જ આવા તત્ત્વોનો સફાયો કરવાનો તખ્તો ગોઠવાયો હતો પણ નબળી નેતાગીરી અને જે તે સમયની પરિસ્થિતિએ તેમને ઉગારી લીધા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે અધિવેશનની ઘટનાને ભૂલીને મવાળવાદીઓ ફરી પાછા વોહી રફતારમાં આવી જતા આવા લોકોનો કાયમી 'ઈલાજ' જ તેનો ઉકેલ છે તેવું જ્ઞાતિજનોએ અનુભવ્યું હતું અને તે માટે યોગ્ય સમય અને તકની રાહ જોઈ રહ્યા હતા.

૧૪ ઓગસ્ટ, કેન્દ્રીય સમાજની વાર્ષિક સામાન્ય સભાએ આ તક આપી દીધી ! દરેક સનાતનીઓ મનમાં બધા સમજતા જ હતા કે આ આખરી તક છે ! આમાં ગાફેલ રહ્યા તો બીજા ત્રણ વર્ષ દૂધ-દહીંમાં જ જશે ! કોઈ વિકાસશીલ સમાજને આવું પોસાય નહીં તેથી 'ફેંસલો' કરવો હોય તો આંજે જ તેવા દૃઢ નિર્ધાર સાથે સનાતનીઓએ વહેલી સવારથી જ પાટીદાર વિદ્યાર્થી ભવન તરફ કૂચ શરૂ કરી દીધી હતી.

પાટીદાર વિદ્યાર્થી ભવનની બહાર યુવાનોની ટીમોએ સુંદર કામગીરી બજાવી હતી. કેન્દ્રીય સમાજના આજીવન સભ્યોને તેમના નંબર શોધી આપી ઓળખકાર્ડ આપવાની સાથે બહારના ભાંગફોડીયા તત્ત્વો સભામાં પ્રવેશી ખલેલ ન કરે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

આગલા દિવસે ૧૩ ઓગસ્ટના મળેલ કેન્દ્રીય સમાજની કારોબારી બેઠકમાં પણ નવા પ્રમુખ અને ટ્રસ્ટીમંડળને મુદ્દે કોઈ સહમતિ સધાયેલ ન હોઈ, સામાન્ય સભામાં આ મુદ્દો પેચીદો બનશે તેવી ધારણા હતી જ. બેઠકોના નિરંતર દોર ચાલી રહ્યા હોવા છતાં ભાંગફોડીયા તત્ત્વોની મેલી મુરાદને કારણે નિર્ણય લેવાતો નહોતો.

બરાબર ૯.૦૦ ના ટકોરે સામાન્ય સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. મિટિંગના રૂટીન એજન્ડામાં તો કોઈ સભ્યને રસ હોય તેવું દેખાતું નહોતું. કારોબારી અને ટ્રસ્ટીમંડળની નવી રચના તરફ જ બધા મીટ માંડીને બેઠા હતા. આખરે એ એજન્ડા પણ આવી પહોંચ્યો જે વર્તમાન સમાજનું નવું ભવિષ્ય કંડારવાનો હતો.

હાઈકોર્ટે સમાજના જૂના બંધારણ મુજબ જ કાર્યવાહી કરવા નિર્દેશ આપેલ હોઈ ટ્રસ્ટીમંડળની ચૂંટણી કરવી કે કેમ તે મુદ્દે સભામાં અવઢવ પેદા થઈ હતી અને આ બાબતે કેટલાક લોકોએ ખોટો હોબાળો પણ સર્જયો હતો. નવા બંધારણ મુજબ ટ્રસ્ટીઓની મુદત ત્રણ વર્ષે પૂર્ણ થતી હોઈ



ખબરદાર ! આજીવન સભ્ય સિવાયના અન્ય કોઈ અંદર સભામંડપમાં ગયું છે તો... સમાજના યુવા કાર્યકરોએ સભા સ્થળે દરેકને ઓળખકાર્ડ આપવા જડબેસલાક વ્યવસ્થા ગોઠવી હતી.

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1393/page/n5/mode/1up

realpatidar.com

તેમની ચૂંટણી કરવી પડે જ્યારે જૂના બંધારણ મુજબ ટ્રસ્ટીઓની મુદ્દત ૬ વર્ષની હોઈ તેમને હજુ ત્રણ સુધી ચાલુ રાખવા પડે. સભામાં આ મુદ્દે અભૂતપુર્વ ગરમા ગરમી સર્જાઈ હતી.

હાઈકોર્ટના આદેશની આડમાં કેટલાક ટ્રસ્ટીઓ અને મવાળવાદી આગેવાનો જૂના બંધારણ મુજબ હોદ્દા પર ચીટકી રહેવાના મનસૂબા સેવી રહ્યા હતા પણ સભામાં ઉપસ્થિત સનાતનીઓએ તેમના મનસૂબા પાર પાડવા દીધા નહોતા. નૈતિક રીતે પણ મુદ્દ પૂર્ણ થતી હોઈ સ્વેચ્છાએ રાજીનામું ધરી દઈ મડાગાંઠનો અંત લાવવો જોઈએ તેવી સમજુ વડીલોની અપીલ પણ સ્ટેજ પર ચીટકીને બેઠેલા ટ્રસ્ટીઓએ કાને ન ધરતાં સનાતનીઓએ ભારે દેકારો મચાવ્યો હતો.

સનાતનીઓ એક જ રટ લઈને બેઠા હતા કે તમામ ટ્રસ્ટીઓ પહેલાં રાજીનામું આપી દે. પછી ભલેને ફરીથી ચૂંટાઈ આવે. સભાનો આક્રોશ અને મૂડ જોઈ ધીમે ધીમે એક પછી એક ટ્રસ્ટીઓએ પોતે રાજીનામું આપે છે તેવી જાહેરાત કરી હતી પણ જયેષ્ઠ ટ્રસ્ટી શિવદાસ ગોવિંદ છાભૈયા સહિતના કેટલાક ટ્રસ્ટીઓએ આ કાર્યવાહીમાં પણ ઢીલ કરતાં ઉપસ્થિત સભ્યોએ અને સમગ્ર સભાએ ભારે દેકારો મચાવી તેમને પણ રાજીનામું દેવાની ફરજ પાડી હતી !

સનાતનીઓના મૂડ પારખી ગયેલ મવાળવાદી તત્ત્વોએ જો સભા આગળ ચાલશે તો આજે બધાના સૂપડાં સાફ થઈ જશે તેવી ભીતીથી સભા ખોરંભે ચઢે તેવા પ્રયાસો શરૂ કરી દીધા હતા તે સભામાં સ્પષ્ટ દેખાતું હતું. વડીલ જેવા ટ્રસ્ટીઓને આમ અપમાનીત કરીને કાઢવાના પ્રશ્ને મુદ્દો બનાવી સ્ટેજ ઉપરથી જ કેટલાક અગ્રણીઓએ હાકલા-પડકારા કરતાં સભામાં અભૂતપુર્વ શોકબકોર સર્જાયો હતો જેને લઈ સભા પ્રમુખ શ્રી રામજી કરમશી નાકરાણીને સભા બપોરના ૨.૩૦ સુધી મુલત્વી રાખવાની ફરજ પડી હતી.

ભોજન વિરામના સમયમાં પણ સમગ્ર સભા મંડપમાં એક જ ચર્ચા હતી કે સભાનું કામકાજ આગળ ચાલશે કે કેમ? બીજી તરફ વિદ્યાર્થી ભવનના એ.સી. મિટિંગ હોલમાં પણ કેટલાક હોદ્દેદારોને પસીનો છૂટી રહ્યો હતો. સંદેશો સ્પષ્ટ હતો : બપોર પછી થનારી કાર્યવાહીમાં કોનો કોનો ભોગ લેવાશે તે કંઈ કહેવાય નહીં !

પરંતુ બપોર પછીની સભા શરૂ થાય તે પહેલાં પ્રખર સનાતની અગ્રણી બેંગલોરના રમેશભાઈ માવજી વાગડીયાએ માઈક હાથમાં લીધું અને સભાને લાગણીસભર વાણીમાં દર્દભરી અપીલ કરી કે આપણે સૌએ શાંતિથી સભાનું કામકાજ આગળ ધપાવવાનું છે. મવાળવાદી તત્ત્વો સભા ખોરંભે પડે તેવા પ્રયાસો કરી રહ્યા છે પણ આપણે જે કામ માટે આજે ભેગા થયા છીએ તે કામ પૂર્ણ કરીને જ ઝંપવાનું છે. સમગ્ર સભાએ કીકીયારીઓ અને ગગનભેદી નારાથી વાગડીયાની વાતને વધાવી લીધી હતી.

ભારે સસ્પેન્સ અને કંઈક અંશે દહેશતભર્યા માહોલમાં બપોર પછી



સસ્પેન્સ ! આ વખતની સામાન્ય સભામાં કંઈક 'નવા-જૂની' કરવાના મૂડ સાથે દેશભરમાંથી ઉમટી પડેલા સનાતનીઓએ સભામાં અદ્‌ભૂત માહોલ સર્જયો હતો.

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1393/page/n6/mode/1up

realpatidar.com

કેન્દ્રીય સમાજના ટ્રસ્ટીઓ

૧.	શ્રી રામજી કરમશી નાકરાણી	- રાયપુર
૨.	શ્રી લધા વિશ્રામ પોકાર	- મુંબઈ
૩.	શ્રી લખમશી નાયા દિવાણી	- કોલકતા
૪.	શ્રી વાલજી નારાણ ભગત	- નાગપુર
૫.	શ્રી ગોપાલ વાલજી ભાવાણી	- કોલ્હાપુર
૬.	શ્રી બાબુલાલ હીરજી ચૌહાણ	- મુંબઈ
૭.	શ્રી કરસન સામજી સેંઘાણી	- સુરત
૮.	શ્રી દયારામ નથુ મૈયાત	- દયાપર
૯.	શ્રી માવજી કેશરા રામાણી	- નખત્રાણા
૧૦.	શ્રી લક્ષ્મણ નાનજી ચૌહાણ	- દિલ્હી
૧૧.	શ્રી ઈશ્વરલાલ માવજી ભગત	- કોટડા (જ)

સભાની કાર્યાવહી શરૂ થઈ. ચૂંટણી કઈ પદ્ધતિથી કરવી તે બાબતે સભામાં જુદા જુદા સભ્યોએ અભિપ્રાય આપેલ. આખરે અગાઉની જેમ સભામાંથી જ પંચોની રચના કરી તેઓ જે નક્કી કરે તે માન્ય કરવું તેવું સભાએ સર્વાનુમતે ઠરાવતાં સભાની આગળની કાર્યવાહી કંઈક અંશે સરળ બની.

વર્તમાન પ્રમુખ શ્રી રામજી કરમશી નાકરાણીની આગેવાની હેઠળ નિમવામાં આવેલ પંચોમાં સર્વશ્રી રતિભાઈ મણીલાલ રામાણી, મોહનલાલ શીવજી ધોળુ, ધનજીભાઈ છાભૈયા અને અબજીભાઈ કાનાણીનો સમાવેશ કરવામાં આવેલ. આ પંચમાં વાલજી નારાણ ભગત અને દુર્ગાપરના ગોવિંદ અબજી સેંઘાણીની પણ જાહેરાત કરવામાં આવેલ પણ બંને જણાએ અનિચ્છા દર્શાવતાં તેમને પડતા મૂકવામાં આવેલ.

સામાન્ય સભાએ આ સીલેક્શન પંચની રચના માટે સભ્યો પસંદ કરવાની સંપૂર્ણ સત્તા પ્રમુખ શ્રી રામજી કરમશીને આપી હોવા છતાં તેમના તરફથી જાહેર થયેલી પંચોના નામ સામે વાંધો લઈ, માંડવી અને ભુજના કેટલાક અગ્રણીઓએ પ્રમુખશ્રીએ એકતરફી વલણ અપનાવ્યું હોવાનો આક્ષેપ કરી સભા મંડપ છોડી જતાં ફરી એક વખત સભામાં શોરબકોર મચી ગયો હતો.

જો કે, સભામાં ઉપસ્થિત ૬ થી ૭ હજારની જનતા સવારથી જ જોઈ રહી હતી કે માંડવી અને ભુજના કેટલાક અગ્રણીઓએ નાની વાતને પણ મુદ્દો બનાવી સભાનું કામ ખોરવાય તેવા પ્રયાસો કરતા હતા પણ આ વખતે તેમની કોઈ કારી ફાવી નહોતી. સભામાં તેઓ સ્પષ્ટ રીતે ખુલ્લા પડી ગયા હતા.

સીલેક્શન પંચ સમક્ષ સૌ પ્રથમ પ્રમુખપદના ઉમેદવાર માટે નામ રજૂ કરવાની જાહેરાત થતાં જ સભામાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. કુલ ૨૮ દરખાસ્તો સભામાંથી આવી હતી. આકાશમાં વાદળો ઘેરાઈ ગયા હતા અને ઝરમર વરસાદ પણ પડી રહ્યો હતો પણ મિટિંગ હોલમાં ગયેલા પંચના સભ્યો શું પરિણામ લાવે છે તે જાણવા સમગ્ર સભા એકીટશે મિટિંગ હોલના દરવાજા તરફ મીટ માંડી બેઠી હતી !

આખરે સસ્પેન્સનો અંત આવ્યો. રામજી કરમશી નાકરાણીએ શ્રી અખિલ ભારતથી કચ્છ કડવા પાટીદાર સમાજના નવા પ્રમુખ તરીકે દિલ્હી નિવાસી યુવા સંઘના માજી પ્રમુખ અને સ્વર્ણિમ મહોત્સવના ચેરમેન રહી ચૂકેલા ગંગારામ હિરાલાલ સાંખલાની જાહેરાત કરી તે સાથે જ સમગ્ર સભામાં હર્ષનાદો અને કીકીયારીથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. સભામાંથી સતત 'સનાતન ધર્મ કી જય'ના ગગનભેદી નારા પણ સંભળાતા હતા !

સનાતનીઓમાં અભૂતપુર્વ ઉત્સાહ છલકાઈ રહ્યો હતો. પ્રમુખપદનો પહેલો કોઠો તો પાર કરી દીધો, હવે બાકીની કાર્યવાહી પણ સફળતાપૂર્વક પાર પાડવા સભાજનો અધીરાઈથી મિટિંગના આગળના એજન્ડાની રાહ જોઈ રહ્યા હતા. સભામાં સર્વત્ર સનાતની ઉન્માદ જોવા મળી રહ્યો હતો. જે અગાઉ ક્યારેય પણ જોવા મળ્યો નહોતો.

સમગ્ર સભાનો આવો ઉગ્ર સનાતની માહોલ જોઈ મવાળવાદીઓ તો રીતસર ડઘાઈ ગયા હતા. અત્યાર સુધી સમાજમાં જે રીતે 'ફીલમ' ચલાવતા આવ્યા હતા તે આ વખતે ન ચાલતા કંઈ અંશે હતાશ થયેલા પણ નજરે ચઢ્યા હતા. જનતા જ્યારે જાગે છે ત્યારે ભલભલાને સિંહાસન ખાલી કરવા પડે છે તેનો પ્રત્યક્ષ અનુભવ ટ્રસ્ટીઓને થઈ ગયો હતો.

પ્રમુખની જેમ ટ્રસ્ટીઓની વરણી માટે



કાનાફૂસી : આ વખતે સભાજનો નમતું જોખવાના મૂડમાં નથી તો શું કરશું?

realpatidar.com

https://archive.org/details/bk1393/page/n7/mode/1up

2011-09 -Patidar Saurabh (1393)

realpatidar.com

Devji Mavji -Fun Faced

પણ દરખાસ્તો મંગાવવામાં આવતાં જે નામો આવેલા તેમાંથી સીલેક્શન પંચે ૧૧ નામોની ટ્રસ્ટી તરીકે જાહેરાત કરી ત્યારે સમગ્ર સભાએ હાથકારો અનુભવ્યો હતો. તાળીઓના પ્રચંડ ગડગડાટથી સભાએ નવા ટ્રસ્ટીઓને વધાવી લીધા હતા.

કુલ ૧૧ ટ્રસ્ટી પૈકી છેલ્લી ટર્મમાં રહેલા માત્ર ૪ ટ્રસ્ટીઓને જ નવા ટ્રસ્ટ મંડળમાં પુનઃ લેવામાં આવ્યા છે. બાકીના ૭ ટ્રસ્ટીઓની નિમણુંકમાં તમામ વિસ્તારોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તેનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. માંડવી વિસ્તારના બે સભ્યોને પણ ટ્રસ્ટીપદે લેવામાં આવ્યા છે.



મારો વાંક શું? મારો ગુનો શું? આ છોકરાઓએ બાજી બગાડી નાખી, નહીં તો...

આ રીતે કારોબારી સભ્યોની નિમણુંક માટે પણ સભામાં નામ મંગાવવામાં આવતાં રાફડો ફાટ્યો હોય તેમ નામ નોંધણી માટે ધસારો થયો હતો. જેમનું નામ નોંધાવવાનું હોય તેમની દરખાસ્તમાં સમાજના બે આજીવન સભ્યોની સહી ફરજીયાત બનાવતાં કેટલાક લોકો ઉંઘતા ઝડપાયા હતા અને વંચીત રહી ગયા હતા.

કારોબારી માટે નામો ઘણા બધા આવેલ હોઈ અને તમામ વિસ્તારોને પ્રમાણસર પ્રતિનિધિત્વ મળી રહે તે પણ જોવાનું હોઈ ૪૦ સભ્યોની કારોબારી પસંદ કરવામાં પંચના સભ્યોને ખાસ્સો વ્યાયામ કરવો પડ્યો હતો. સમાજના કેટલાક સક્રિય સભ્યોની આ યાદીમાં બાદબાકી થઈ ગઈ હોવા છતાં સમગ્ર સભાએ તાળીઓના ગડગડાટથી કારોબારી સભ્યોને પણ વધાવી લીધા હતા.

સભાનું કામ તો પુરું થઈ ગયું હતું. હવે કેબીનેટની નવી રચનામાં પ્રમુખની કસોટી થવાની હતી. ચૂંટાયેલા કારોબારી સભ્યો અને ટ્રસ્ટીઓ પ્રમુખશ્રીની સાથે મિટિંગ હોલમાં ગયેલ અને ચર્ચા-વિચારણાને અંતે હોદેદારોની યાદી લઈ નીચે ઉતર્યા ત્યારે રાત્રીનું ભોજન લઈ ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહેલા સભ્યોની આતુરતાનો અંત આવ્યો હતો.

મહામંત્રી તરીકે અગાઉ વરસો સુધી મંત્રીપદે રહી ચૂકેલા વિથોણના માવજી કેશરા ભગત સિવાય ગંગારામભાઈના મંત્રીમંડળમાં ખાસ કોઈ મોટો ફેરફાર ન થતાં સભામાં થોડું આશ્ચર્ય જરૂર સર્જાયું હતું. કારણ ટ્રસ્ટીમંડળમાં જે રીતે વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા તે રીતે હોદેદારોની વરણીમાં ઝાઝું પરિવર્તન દેખાયું નથી ! હોદેદારોની જાહેરાત બાદ સભામાં છૂપો ગણગણાટ પણ જોવા મળ્યો હતો પણ જે થયું તે સારું તેમ માની લોકોએ મન મનાવી લીધું હતું !

ત્રણ ઉપપ્રમુખો પૈકી મનસુખભાઈ રૂડાણી અને દેવજીભાઈ ભાવાણીને રીપીટ કરવામાં આવ્યા છે. ઉપપ્રમુખનું ત્રીજું પદ હાલમાં ખાલી રાખવામાં આવેલ છે. એવું સમજાય છે કે માંડવી વિસ્તારના ભાઈઓ માટે આ પદ 'અનામત' રાખવામાં આવેલ છે.

કેન્દ્રીય કારોબારીની ૪૦ ની યાદીમાં બાકાત રહી ગયેલા સભ્યોએ હવે કો-ઓપ્ટ. અને આમંત્રિત સભ્ય તરીકે કારોબારીમાં પ્રવેશ મેળવવા લોબીંગ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળે છે. આ બંને



સ્વર્ણિમ મહોત્સવના અહેવાલનું વિમોચન કરી રહેલા દાતા પરિવારના સભ્યો, કેન્દ્રીય સમાજના પદાધિકારીઓ અને પ્રકાશન સમિતિના સભ્યો.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1393/page/n8/mode/1up

2011-09 -Patidar Saurabh (1393)

realpatidar.com

કેટેગરીના સભ્યોની વરણીમાં વર્તમાન નવા પ્રમુખશ્રી કેવો માપદંડ અપનાવે છે તે તો તેની જાહેરાત થાય તે પછી જ ખબર પડશે.

નવા વરાયેલા પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંખલાએ સમાજ જે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તેમાંથી બહાર નીકળવા સૌના સાથ-સહકારની અપીલ કરી, સમાજે જે પરિવર્તન માટે આ જનાદેશ આપ્યો છે તેના અમલ માટે પોતે કટિબદ્ધ હોવાની ખાત્રી આપી હતી.

પંચમ અધિવેશન વખતે જ શ્વેતપત્રની ભાવનાની વિરુદ્ધ વર્તન કરનાર સમાજના કેટલાક ટોચના હોદેદારોને ખુરશી પરથી નીચે ઉતારવા જનતાએ જેહાદ ચલાવી હતી પણ તે વખતે પૂર્ણ ન થયેલ કાર્ય આ વખતની સામાન્ય સભામાં પુરું થતાં દેશભરમાંથી ઉમટી પડેલા સનાતનીઓમાં હર્ષની હેલી છવાઈ ગઈ હતી.

પ્રખર સનાતની સર્વ શ્રી હિંમતભાઈ ખેતાણી, રમેશભાઈ વાગડીયાની આગેવાની હેઠળ છેલ્લા બે વર્ષથી દેશભરમાં ચલાવવામાં આવેલ જનજાગૃતિ અભિયાનને કારણે લોકોમાં જે જાગૃતિ આવી હતી તેના પડઘા આ વખતની સામાન્ય સભામાં જોવા મળ્યા હતા.

મુંબઈના અબજીભાઈ કાનાણી, પ્રેમજીભાઈ કેશરાણી, નખત્રાણાના ડૉ. શાંતિલાલ સેંઘાણી, ડાહ્યાભાઈ સેંઘાણી, અંગીયાના છગનભાઈ પારસીયા, બેંગલોરના રમેશ ગોરાણી, ધનજીભાઈ છાભૈયા, મુંબઈના વિરાણીગઢ નિવાસી શામજીભાઈ પટેલ સહિત 'Real Patidar' ની ટીમે સનાતનીઓને જાગૃત કરવા જે અભિયાન આદર્યું હતું તે આખરે પરિવર્તન લાવીને જ રહ્યું હતું.

કેન્દ્રીય સમાજના આ વખતના ચુનાવને લઈ દેશભરમાં જબરી ઉત્કંઠા અને સસ્પેન્સનો માહોલ હતો. અનેક પ્રકારની અફવાઓ પણ ઉઠતી હતી. પણ આખરે લોકલાગણીનો વિજય થયો તેનો આનંદ સામાન્ય સભામાં ઉપસ્થિત સૌ સભ્યોના ચહેરા પર ડોકાતો હતો.

પરિવર્તનનો પવન ફૂંકાયા બાદ સમાજમાં જ્યારે નવો સૂર્યોદય થયો છે ત્યારે આગામી વરસોમાં સમાજ પ્રગતિના નવા શિખરો સર કરે તેવી આમ જનતાની હાર્દિક શુભેચ્છા સાથે કેન્દ્રીય સમાજના નવા સુકાનીઓ હિંમતથી આગળ વધે તેવી પણ વ્યાપક લોકલાગણી છે.

કારોબારી સભ્યો

ડૉ. પ્રેમજીભાઈ રામજી ગોગારી	ગાંધીધામ
પન્નાલાલ કરસન દિવાણી	રાયપુર
જશવંતભાઈ દેવજી સાંખલા	ઘડુલી
ગંગારામભાઈ શીવદાસ રામાણી	ભુજ
દેવજીભાઈ માધવજી નાકરાણી	જોરાવરનગર
ભરતભાઈ શીવજી પોકાર	સારસા
હરિલાલ નારણ ધોળુ	નાગલપુર
નારણભાઈ ખેતા રૂડાણી	કલકતા
દેવશંકરભાઈ સોમજી ધનાણી	વડોદરા
મુળજીભાઈ કરમશી ચૌધરી	ભીંવડી
મણીલાલ વિશ્રામ લીંબાણી	અમદાવાદ
મેગજીભાઈ પ્રેમજી દિવાણી	કોટડા
બાબુભાઈ વાલજી ભગત	બેંગલોર
મહેન્દ્રભાઈ જીવરાજ સેંઘાણી	મુંબઈ
પ્રેમજીભાઈ ભાણજી કેસરાણી	નવી મુંબઈ
છગનભાઈ માવજી રામાણી	નખત્રાણા
નારણભાઈ જીવરાજ રૂડાણી	ભુજ
પ્રો. કે. વી. પાટીદાર	ભુજ
સામજીભાઈ રામજી લીંબાણી	નખત્રાણા
ડાયાલાલ નારણ સેંઘાણી	નખત્રાણા
મણીલાલ હીરજી ભગત	બીદડા
રતનશીભાઈ લાલજી દિવાણી	મુંબઈ
લક્ષ્મણભાઈ શીવગણ માવાણી	ભુજ
કાંતીલાલ વીરજી ધોળુ	મુંબઈ
રામજીભાઈ માવજી બાથાણી	ભીવંડી
હંશરાજભાઈ પ્રેમજી દિવાણી	વિરાણી મોટી
મગનભાઈ ગોવિંદ રામાણી	બારડોલી
નાનજીભાઈ હંશરાજ નાકરાણી	વિથોણ
શંકરલાલ દેવજી પદમાણી	માનકુવા
પુંજાભાઈ પચાણ પટેલ	નડીયાદ
વસંતભાઈ રાજાભાઈ લીંબાણી	મોડાસા
ઈશ્વરભાઈ હીરજી ગોરાણી	થાણા

વાચકોએ નોંધ લેવી

પાટીદાર સૌરભનો આગામી અંક તા.૧૫-૧૦-૨૦૧૧ના દીપોત્સવી અંક તરીકે પ્રસિદ્ધ કરવામાં આવશે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library Page 7 of 13
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1393/page/n9/mode/1up

realpatidar.com

નાબૂદ થયેલ ટ્રસ્ટીપદનો હોદ્દો પુનઃ જીવીત કરાયો

કેન્દ્રીય મહિલા સંઘના પ્રમુખપદે દિલ્હીના ઝવેરબેન સાંખલા



મહિલા સંઘના નવા વરાયેલા પ્રમુખ ઝવેરબેન સાંખલા અને મહામંત્રી સોનલબેન શેઠીયા

શ્રી સાંખલા ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘના આગામી ત્રણ વર્ષના પ્રમુખપદે દિલ્હીના શ્રીમતી ઝવેરબેન ગંગારામભાઈ સાંખલા અને મહામંત્રીપદે નખત્રાણાના શ્રીમતી સોનલબેન ઈશ્વરભાઈ શેઠીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે તા.૧૨-૮-૨૦૧૧ના મહિલા સંઘના પ્રમુખ શ્રીમતી પ્રભાબેન દામજી માકાણીના અધ્યક્ષસ્થાને મળેલી સંઘની વાર્ષિક સામાન્ય સભામાં વર્તમાન કારોબારી અને હોદ્દેદારોની મુદ્દત પૂર્ણ થતાં સર્વાનુમતે નવી કારોબારીની ત્રણ વર્ષ માટે વરણી કરવામાં આવી હતી.

જ્ઞાતિજનોની ધારણા મુજબ જ ગત ટર્મમાં સંજોગોવસાત પ્રમુખપદથી વંચિત રહી ગયેલા ઝવેરબેન સાંખલાને આ વખતે પ્રમુખપદની ખુરશી નસીબ થઈ હતી. અગાઉ મહામંત્રી તરીકે ફરજ બજાવી ગયેલા વર્તમાન ખજાનચી સોનલબેનને ફરીથી પ્રમોશન આપી મહામંત્રીનું સુકાન સોંપવામાં આવ્યું છે.

વિદાય લેતા પ્રમુખ શ્રીમતી પ્રભાબેન માકાણીને ટ્રસ્ટી તરીકે સમાવવામાં આવ્યા છે. કારોબારીના ૩૫ સભ્યોમાં દેશભરમાંથી મહિલાઓને લેવામાં આવી છે.

વિદાય લઈ રહેલા પ્રમુખ પ્રભાબેને જણાવ્યું હતું કે કેન્દ્રીય સમાજના સભ્ય હશે તે જ બહેનોને મહિલા સંઘની કારોબારીમાં સ્થાન મળશે. જેથી કારોબારી બહેનોએ કેન્દ્રીય સમાજના સભ્ય બનવું જ પડશે. વિદાય લેતી કારોબારીને જેવો સાથ અને સહકાર આપ્યો તેવો જ સાથ નવી કારોબારીને આપવા સૌને ભલામણ કરેલ.

નવા વરાયેલા પ્રમુખ ઝવેરબેન સાંખલાએ પોતાના ઉદ્બોધનમાં જણાવેલ કે આપણે સૌએ સાથ અને સહકારથી એક સાંકળ બની સૌના પૂરક બનીને કામ કરવાનું છે. મારા પર વિશ્વાસ મૂકી મને પ્રમુખપદની જે જવાબદારી સુપ્રત કરી છે તે આપના સાથ સહકારથી તન-મન-ધનથી પૂરી નિષ્ઠાથી નિભાવવાની કોશીશ કરીશ.

આ સામાન્ય સભામાં ખુલ્લો મંચ પણ યોજાયો હતો જેમાં ભારતભરમાંથી આવેલ મહિલા પ્રતિનિધિઓએ મહિલાઓના વિકાસ અને સંગઠન બાબતે તેમના વિચારો રજૂ કરી મહિલા સંઘને પ્રગતિના ઉન્નત શિખરે પહોંચાડવાના સહિયારા પ્રયાસો હાથ ધરવા અપીલ કરી હતી.

સામાન્ય સભાના આગલા દિવસે મહિલા સંઘની મળેલ કારોબારી સભામાં અન્ય ચર્ચા-વિચારમા ઉપરાંત ભાનુબેન પટેલે મહિલા સંઘમાં ટ્રસ્ટીપદ પાછું લાવવાનો ઠરાવ રજૂ કરેલ. જેની ચર્ચામાં ભાગ લેતાં લક્ષ્મીબેને જણાવેલ કે મહિલા સંઘનું કોઈ ટ્રસ્ટ નથી તો આપણને ટ્રસ્ટીપદની જરૂર જ ક્યાં છે? ચર્ચાના અંતમાં ટ્રસ્ટી પદ પાછું લાવવાનો ઠરાવ મંજુર કરવામાં આવેલ.

આ સભામાં કચ્છસહિત દેશભરમાંથી મહિલામંડળીની પ્રતિનિધિબહેનો હાજરી આપી જાગૃતિના દર્શન કરાવ્યા હતા.

ટ્રસ્ટીઓ

૧.	ભાનુબેન વાલજીભાઈ સાંખલા	-	ભુજ
૨.	લક્ષ્મીબેન રવજીભાઈ ભાદાણી	-	હોસુર
૩.	રતનબેન માવજીભાઈ ભગત	-	ભુજ
૪.	ગંગાબેન હરીભાઈ સેંઘાણી	-	કલકતા
૫.	પ્રભાબેન દામજીભાઈ માકાણી	-	ભુજ

કેન્દ્રીય મહિલા સંઘના નવા હોદ્દેદારો

પ્રમુખ	-	ઝવેરબેન ગંગારામભાઈ સાંખલા	-	દિલ્હી
ઉપપ્રમુખ	-	ગંગાબેન હરીભાઈ ધોળુ	-	પેટલાદ
ઉપપ્રમુખ	-	સુશીલાબેન કાંતિલાલ પાટીદાર	-	ભુજ
ઉપપ્રમુખ	-	કંચનબેન ભવાનજી રામાણી	-	બિદડા
મહામંત્રી	-	સોનલબેન ઈશ્વરભાઈ શેઠીયા	-	નખત્રાણા
મંત્રી	-	રમીલાબેન ખેતશીભાઈ રવાણી	-	નાશિક
મંત્રી	-	હેમલતાબેન રવિલાલ પારસીયા	-	મુંબઈ
મંત્રી	-	રાધાબેન ગોપાલભાઈ દિવાણી	-	ઔરંગાબાદ
ખજાનચી	-	માલતીબેન જયેન્દ્રભાઈ ચૌહાણ	-	ભુજ
સહખજાનચી	-	હીરાબેન શામજીભાઈ કેશરાણી	-	નખત્રાણા

realpatidar.com

https://archive.org/details/bk1393/page/n10/mode/1up

2011-09 -Patidar Saurabh (1393)

realpatidar.com

મહિલા મેળાવડો
કોણ... શું બોલ્યું?

આજની સાસુ-વહુ વચ્ચે સહનશીલતાનો અભાવ છે. બંને વચ્ચેના ઝઘડામાં બંનેના દુરાગ્રહ અને સ્વભાવ નડતા હોય છે. સાસુ-વહુએ આ દુરાગ્રહને છોડી ઘરને સ્વર્ગ બનાવવું જોઈએ.

દિકરીઓએ ભણીગણીને ખૂબ જ આગળ વધવાની સાથે સાથે પિતા અને જ્ઞાતિની આબરૂનો પણ ખ્યાલ રાખવો જોઈએ.

- વેદિક ભીમાણી (રત્નાપર)

નખત્રાણા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનપદે છું. બહેનો સાથ-સહકાર માટે ગમે ત્યારે મને મળી શકે છે. મારાથી બનતા તમામ પ્રયાસો અને સહકારની ખાત્રી આપું છું.

- લક્ષ્મીબેન એમ. નાથાણી (નખત્રાણા)

નારી શક્તિ મહાન છે અને રહેશે, પણ નારીને પોતાની જ કદર નથી હોતી. સમાજને આગળ લઈ જવો હશે તો નારીએ પોતાની કદર કરતાં પણ શીખવું પડશે.

- ચંદાબેન પટેલ (નરોડા)

આપણે સૌએ અહીંથી વિચારોનું મંથન કરી, વલોવણું કરીને અહીંથી કંઈક લઈ જવાનું છે. આગળ આવતી બહેનોને સાથ આપી એક મજબૂત સાંકળ બનાવવાની છે. સૌએ સાથે મળી આપણી શક્તિને કામે લગાડવાની છે.

- નર્મદાબેન સેંઘાણી (સુરત)

ટીકા કરવી સહેલી છે, પણ સુધારો કરવો મુશ્કેલ છે. કોઈ આપણી ટીકા કરે તો પાછા નહીં હટતા હિંમતથી આગળ વધવું જોઈએ.

- વર્ષાબેન (આણંદપર)

દિકરી ભાગી જાય ત્યારે એના માવતરને ખૂબ સહન કરવાનું આવે છે. લોકો તેને હડધૂત કરે છે. એની સાથેના વ્યવહાર કટ કરે છે. જ્યારે દિકરો બીજી નાતની લઈ આવે તો તેની સાથે કેમ આવો વ્યવહાર કરવામાં આવતો નથી?

- જયાબેન સાંખલા (નવસારી)

આપણે હવે જગદંબા બનીને વ્યસન મુક્તિ પર ભાર આપવો પડશે. જેના પણ પતિને વ્યસનની આદત હોય એની પત્નીએ રણચંડી બનવું જ પડશે.

- કંચનબેન પટેલ (બિદડા)

મહિલા સંઘના કારોબારી સભ્યો

(૧)	જયાબેન માવજીભાઈ લીંબાણી	- નડિયાદ
(૨)	ગંગાબેન મણીલાલ લીંબાણી	- દયાપર
(૩)	ઉર્મિલાબેન નાનજીભાઈ ડાયાણી	- ધાવડા-મોટા
(૪)	શાન્તાબેન ઈશ્વરભાઈ કમાણી	- નખત્રાણા
(૫)	લીલાબેન ગીરધરભાઈ રૂડાણી	- દેશલપર
(૬)	લીલાબેન મોહનલાલ ચોપડા	- મુંબઈ
(૭)	કસ્તુરબેન પુરુષોત્તમ નાકરાણી	- ગાંધીધામ
(૮)	જશોદાબેન બાબુલાલ નાથાણી	- નિરોણા
(૯)	શાન્તાબેન જેઠાલાલ જાદવાણી	- નેત્રા
(૧૦)	હંસાબેન શાંતિલાલ નાકરાણી	- ખોંભડી
(૧૧)	ગંગાબેન હરીભાઈ ધોળુ	- નાગલપર
(૧૨)	રૂકમણીબેન જયંતિલાલ ખેતાણી	- સમ્બલપુર
(૧૩)	પાર્વતીબેન વિશ્રામ દિવાણી	- સિકન્દ્રાબાદ
(૧૪)	શાન્તાબેન મગનલાલ સાંખલા	- રસલીયા
(૧૫)	શીલાબેન બાબુલાલ ભગત	- મૈસુર
(૧૬)	વનિતાબેન ભવાનજી ભીમાણી	- દેવપર
(૧૭)	લીલાબેન ગંગારામ ઠાકરાણી	- ભડલી
(૧૮)	દમયંતીબેન રૈયાભાઈ ભગત	- વિથોણ
(૧૯)	પુષ્પાબેન તુલસીદાસ ભગત	- કલકતા
(૨૦)	વનિતાબેન મનોહરભાઈ રૂડાણી	- કલકતા
(૨૧)	હંસાબેન બાબુલાલ સાંખલા	- દિલ્હી
(૨૨)	જાગૃતિબેન અશ્વિનભાઈ વેલાણી	- લુડવા
(૨૩)	ચંપાબેન જયંતિલાલ ધનજીયાણી	- નાગપુર
(૨૪)	રતનબેન એમ. પટેલ	- મદ્રાસ
(૨૫)	દમયંતીબેન કાંતિલાલ દડગા	- મમાયમોરા
(૨૬)	દેવકાબેન દામજીભાઈ સાખલા	- વિરાણીમોટી
(૨૭)	વિમળાબેન રમેશભાઈ ખેતાણી	- રામપર-રોહા
(૨૮)	નર્મદાબેન શંકલલાલ રવાણી	- જયપુર
(૨૯)	મંજુલાબેન રવીલાલ પોકાર	- રાયણ
(૩૦)	પાર્વતીબેન અરજણભાઈ હળપાણી	- હરીપુરા
(૩૧)	માયાબેન દોલતભાઈ પટેલ	- માંડવી
(૩૨)	અનુરાધાબેન શાન્તીલાલ સેંઘાણી	- નખત્રાણા
(૩૩)	જ્યોતિબેન ભરતભાઈ ધનાણી	- નખત્રાણા
(૩૪)	જશોદાબેન શાન્તીલાલ નાકરાણી	- ગોવા
(૩૫)	જયશ્રીબેન પ્રકાશભાઈ છાભૈયા	- બલારસા

- સદીઓથી તર્ક અને લાગણી એકબીજાં સાથે ટકરાતાં રહ્યાં છે. તર્કના ચાસ સીધા અને સમાંતર હોય છે. જ્યારે લાગણીની કેડી તો સાવ વાંકી-ચૂંકી ! તર્કનો રસ્તો સાફસૂથરો, જ્યારે લાગણીના ધૂળિયા માર્ગ પર થોડાંક ફૂલ અને કાંટા ઝાઝા !
- આપણા ધર્મ સાથે ઘોંઘાટ ભળી ગયો છે. ભગવાન બહેરો નથી; પણ મંદિરોમાં તો ઘોંઘાટનું વર્ચસ્વ હોય છે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1393/page/n11/mode/1up

2011-09 -Patidar Saurabh (1393)

realpatidar.com

યુવા સંઘની સભામાં કેન્દ્રીય સમાજના પ્રમુખનો અનુરોધ

સમૃદ્ધ સનાતની સમાજના નિર્માણ માટે યુવાધનનો સહયોગ અનિવાર્ય

નખત્રાણા મુકામે પાટીદાર વિદ્યાર્થીભવન ખાતે તા.૧૫-૮-૧૧ના ગૌરાંગ ધનાણીના પ્રમુખસ્થાને કેન્દ્રીય યુવા સંઘની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી જેમાં યુવા સંઘની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી.

ગયા વર્ષે યોજાયેલા સ્વર્ણિમ મહોત્સવ પહેલાં સુરત મુકામે યુવા ઓલીમ્પીયાડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં સમગ્ર ભારતનું યુવાધન જોડાયું હતું. ત્યારબાદ ગત વર્ષે યુવા સંઘની ટીમની પુનઃ રચના કરવામાં આવી અને ૨૦૧૧ના વર્ષને 'અર્થ સંકલ્પ રક્ષા' વર્ષ તરીકે ઉજવવાનું ઈગતપુરી કાર્યશાળામાં નક્કી કરવામાં આવેલ.

જે અનુસંધાને વસતિપત્રક ઓનલાઈન વેબસાઈટ પર ઉપલબ્ધ કરવાનું કાર્ય પુરજોશમાં કન્વીનર પુરસોત્તમ ભગત અંકલેશ્વરની ટીમ સંભાળી રહી છે. તેવી જ રીતે યલો પેજીસના નિર્માણ કાજે બિઝનેશ ડેટા એકત્ર કરી સત્વરે પ્રકાશિત થાય તે માટે કન્વીનર ગૌતમ કેશરાણી અને ધીરજ ડાયાણી ભગત કાર્યશીલ છે. આ થકી યુવા સંઘનું ફંડ રેઝીંગ પણ મોટા પાયે કરવાનો અભિગમ છે જેંનાથી આધુનિકતાનો આવિષ્કાર થઈ શકે અને સતત ફંડથી પાછલી પેઢી ચિંતામુક્ત રહે.

યુવા સુરક્ષા કવચ યોજનાનો પ્રોજેક્ટ સમગ્ર ભારતમાં વહેતો થાય અને તમામ પરિવારો સ્વૈચ્છિક રીતે આ યોજનામાં જોડાય તે માટે યુવા કાર્યકરોને ઝુંબેશ ઉપાડવા આ સભામાં અપીલ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૬ યુવા-યુવતીઓને આ યોજનાનો લાભ આપી શકાયો છે.

એજ્યુકેશનના ડૉ. વસંત ધોળુ દ્વારા તેમની સમિતિએ હાથ ધરેલા પ્રોજેક્ટ બાબતે છણાવટ કરવામાં આવી હતી. યુવા ઉત્કર્ષ સમિતિના નર્મદાબેન સેંઘાણી દ્વારા આગામી સમયમાં રાયપુર તથા નાગપુરમાં તેમજ દરેક રીજીયનમાં કાર્યક્રમો થશે તે માટે જવાબદારી ઉઠાવી છે.

આગામી સમયમાં રમતગમત ક્ષેત્રે રીજીયન કે કાઉન્સીલ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના પ્રોગ્રામ થાય તેવું આયોજન થઈ ચૂક્યું હોઈ દરેક રીજીયનને તેના કાઉન્સીલ સાથે સંપર્કમાં રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય સમાજના નવા વરાયેલા પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંખલા યુવાસંઘની સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજની પ્રવર્તમાન પરિસ્થિતિમાં યુવા સંઘની સમગ્ર ટીમની ખાસ જરૂર પડશે તેવો સંકેત આપ્યો હતો. કેન્દ્રીય યુવા સંઘની પોતાના વખતની અને અત્યારના સમયની ઝાંખી આપી યુવાધનના કર્તવ્ય અને ફરજોની વાતો કરી સનાતન વિચારધારામાં સાથ આપવા અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે અનુરોધ કર્યો હતો.

આગામી સમયમાં કેન્દ્રીય સમાજની નવી ટીમ સાથે ચિંતન અને સંકલન શિબિર રાખવા અંગે યોગ્ય સમય નક્કી કરી આગળ વધવાની શુભેચ્છા પ્રમુખશ્રીએ પાઠવેલ. સ્વર્ણિમ મહોત્સવમાં યુવાસંઘના કાર્યકર્તાઓએ નિભાવેલ જવાબદારીને તેમણે બિરદાવી હતી.

આ સભામાં કાઉન્સીલ પ્રેસીડેન્ટ અને કાઉન્સીલ સેક્રેટરીઓ દ્વારા અહેવાલો અન પ્રોજેક્ટોની ચર્ચા કરવામાં આવી હતી. યુવા સંઘની નવી એડ્રેસ બુકનું વિમોચન કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંખલાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

સભાનું સંચાલન મહામંત્રી હરેશ રામાણી, લીલાધર સુરાણી (નાગપુર) અને તુલસી દિવાણી (રાયપુર) એ કરેલ. આભારવિધી કચ્છ રીજીયનના પ્રમુખ રવિલાલ વાલાણીએ કરેલ.

આ વખતે કેન્દ્રીય સમાજના ચુનાવને લઈને પણ યુવાનોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ❖



realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1393/page/n12/mode/1up

2011-09 -Patidar Saurabh (1393)

realpatidar.com

સત્યનારાયણ પાટીદાર સમાજ નખત્રાણાનો ત્રિવાર્ષિક મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

નખત્રાણા : શ્રી સત્યનારાયણ પાટીદાર સમાજ, નખત્રાણાનો ત્રિવાર્ષિક મહોત્સવ તા.૧૭-૮-૧૧થી તા.૧૯-૮-૧૧ દરમિયાન ધામધૂમથી ઉજવાયો હતો. તા.૧૭-૮-૧૧ના રાત્રે સમાજના યુવાનો-યુવતીઓ તેમજ બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયેલ.

તા.૧૮-૮-૧૧ના રાત્રે સમાજની ત્રિવાર્ષિક સામાન્ય સભા સમાજના પ્રમુખ શ્રી માવજી કેશરાના અધ્યક્ષસ્થાને મળેલ જેમાં સમાજના વિકાસ માટે યુવાનો અને વડીલોએ વિચાર મંથન કરેલ. આ સભામાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધેલ.

સમાજની કારોબારીની મુદ્દત પૂર્ણ થતા આગામી ત્રણ વર્ષ માટે શ્રી માવજી કેસરા રામાણીની પ્રમુખપદે ફરીથી વરણી થયેલ. અન્ય હોદ્દેદારો અને કારોબારી સભ્યો પણ યથાવત રહેલ. માવજી કેસરા મુખી ૧૯૯૯ થી સમાજના પ્રમુખપદે સેવા આપી રહ્યા છે.

તા.૧૯-૮-૧૧ના સવારના ૭.૩૦ કલાકે ભગવાન શ્રી સત્યનારાયણની ભવ્ય અને વિરાટ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર નીકળેલ. બેન્ડવાજા સાથે સમાજના વડીલો, યુવાનો, મહિલાઓ તેમજ બાળકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. સમાજના ભાઈઓએ કામધંધા બંધ રાખ્યા હતા. બપોરના ધજા બદલાવ્યા બાદ મહાઆરતી કરવામાં આવેલ અને ત્યારબાદ સમૂહભોજનનો સર્વેએ લાભ લીધેલ.

રાત્રે યોજાયેલ સરસ્વતિ સન્માન સમારોહમાં કુલ ૧૪૬ વિદ્યાર્થીઓના સન્માન થયેલ. માવજી કેસરા મુખીના અધ્યક્ષસ્થાને યોંજાયેલ આ કાર્યક્રમમાં કેન્દ્રીય સમાજના નવનિયુક્ત પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંખલા, કેન્દ્રીય મહિલા સંઘના પ્રમુખ શ્રીમતી ઝવેરબેન સાંખલા, યુવા સંઘના પ્રમુખ શ્રી ગૌરાંગ ધનાણી, સમાજના ટ્રસ્ટી રતિભાઈ રામાણી, ડાયાભાઈ રામાણી, રતનશીભાઈ પાંચાણી અને સરસ્વતી સન્માન કાર્યક્રમના દાતા સ્વ. ગોવિંદ નાનજી નાથાણી પરિવાર વતી રવજી નાનજી નાથાણી અને સોમજી દેવજી વાલાણી હાજર રહ્યા હતા.

કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંખલાએ તેમના સન્માનના પ્રત્યુત્તરમાં જણાવેલ કે સમગ્ર સમાજે મારા પર જે વિશ્વાસ મૂકેલ છે તેને હું સાર્થક કરીશ. ગત બે વર્ષમાં સમાજ પર આવેલ સંકટમાં યુવાનો ઢાલ બનીને ઉભા હતા તેની પણ તેમણે સરાહના કરેલ.

રાંધણછઠ્ઠ, સાતમ અને આઠમના તહેવારો પણ રંગેચંગે ઉજવવામાં આવ્યા હતા. મહિલા મંડળ અને ઉત્સવ મંડળના સભ્યોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. નાગપંચમીથી જન્માષ્ટમી સુધી દરેક રાત્રીએ એક મિનિટની રોમાંચક સ્પર્ધાઓ યોજાયેલ.

કાર્યક્રમનું સંચાલન મહામંત્રી છગનભાઈ રૈયાણી, અરવિંદ રૈયાણી, શાન્તીલાલ ધનાણી, શૈલેશ પોકાર અને છગન ધનાણીએ કર્યું હતું.

સનાતન સમાજના નિયમોના ભંગ બદલ ઘડાણી સમાજના કેટલાક સભ્યોના સભ્યપદ રદ

ગત ૧૮/૧૯ ઓગસ્ટના ઘડાણી ગામે શ્રી સત્યનારાયણ ભગવાનનો પાટોત્સવ તેમજ અન્ય કાર્યક્રમ યોજાયા હતા. સૌ પ્રથમ તા.૧૮ના સવારના ભગવાનની પાલખીના ચડાવા લેવામાં આવ્યા. ત્યારબાદ જળ યાત્રા કાઢવામાં આવી. ગામના તળાવે ઘણા ભાઈ બહેનોએ રાસ રમી આનંદ માણ્યો. જે ભાઈઓએ ચડાવા આપ્યા હતા તેમને ઘેર ભગવાનની પધરામણી કરવામાં આવી. બપોર પછી સમાજની પરંપરા મુજબ મુંડીયા વેરો તેમજ અન્ય વિધિ સંપન્ન થઈ.

બીજે દિવસે તા.૧૯-૮-૨૦૧૧ના સવારમાં સમાજની સામાન્ય સભા લેવામાં આવી.

ત્યારબાદ સમાજના મંત્રી મગનભાઈ પોકાર દ્વારા આપેલ પત્રોનું વાંચન કરવામાં આવ્યું. ગત બે વર્ષ દરમ્યાન તેમજ મિલન ૨૦૧૦ના થયેલ કાર્યક્રમના આવક જાવકનો હિસાબ રજુ કરવામાં આવ્યો. સમાજના ઘણા ભાઈઓ દ્વારા વર્તમાન કેન્દ્રીય સમાજમાં થઈ રહેલ ગતિ વિધિ બારામાં પ્રકાશ પાડવામાં આવ્યો. અમુક પરિવારોએ સનાતન સમાજમાં સભ્ય બનવા માટે અરજીઓ આપી. આ પરિવારોને સનાતન સમાજના નિયમોની જાણકારી આપવામાં આવી. તેઓ પાસેથી લેખિત બાંહેધરી લઈ તેઓને સમાજના સભ્યો બનાવવામાં આવ્યા. સ્વ. નારાયણ વિસરામ વાસાણી પરિવાર દ્વારા ગત ચોમાસે ૨૦૧૦ સમાજના સભ્ય બનવા માટે અરજી આપવામાં આવી હતી. પરંતુ સનાતન સમાજમાં પ્રવેશ મેળવ્યા પછી અને સમાજના નિયમોની જાણકારી આપી હોવા છતાં, પીરાણા જવું, સતપંથની પૂજામાં ભાગ લેવો, જ્યોતિશ ધામમાં જવું, વગેરે ગતિ વિધિ કરી સનાતન સમાજના નિયમનો છડેચોક ભંગ કર્યો છે. તા.૧૯-૮-૨૦૧૧ના આ મુદ્દે સમાજમાં લાંબી ચર્ચા કરવામાં આવી. ચર્ચાના અંતે સર્વાનુમતે સ્વ. નારાયણ વિસરામ વાસાણી પરિવારના સભ્યપદ રદ કરવામાં આવ્યા છે.

સમાજની વર્તમાન શ્રી જીવરાજ ધનજી રંગાણીના પ્રમુખપદ હેઠળની કારોબારી મંડળને બે વર્ષ માટે ફરીથી નિમણુંક કરવામાં આવી. આ સભામાં બહોળી સંખ્યામાં ભાઈઓએ હાજરી આપી. અંતે આભાર વિધિ પ્રગટ કરી સભા સમાપ્ત કરવામાં આવી.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
Page 11 of 13
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1393/page/n13/mode/1up

realpatidar.com

સંલગ્ન રહીને સેવાધર્મ તથા રાષ્ટ્ર ધર્મનું પાલન કરવું જોઈએ. તેને આપત્તિકાળનું સૌથી મોટું પુણ્ય-પરમાર્થ માનવામાં આવે છે. કમાવા-ખાવામાં અને સમસ્યાઓને ઉકેલવામાં જ લોકો આખી જિંદગી ખર્ચી નાખે છે. જીવનની સાર્થકતાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય એવો પ્રસંગ કોઈક વીરલાઓના જીવનમાં જ આવે છે. મૃત્યુ તો દરેકના જીવનમાં આવે છે. વહેલા-મોડા સૌને મરવાનું જ છે, પરંતુ લોક-પરલોક સુધારનારું, યશને અમર બનાવનારું, કર્તવ્યપાલનનો આદર્શ સંસાર સમક્ષ પ્રસ્તુત કરનારું મોત કોઈક નસીબદારને જ મળે છે. જેમનાં નામો શહીદોની સોનેરી પંક્તિઓમાં ઈતિહાસકારોએ લખ્યાં છે, તેને વાંચતી વખતે દરેક ભાવનાશીલ અંતઃકરણમાં એવો વિચાર ઊઠે છે કે કાશ ! અમને પણ આવી તક મળી હોત, તો મનુષ્ય શરીર ધારણ કરવાનું ધન્ય થઈ જાત.

સદીઓ જૂની ગુલામીની બેડીઓને તોડીને આપણે સ્વતંત્ર થયા છીએ. સ્વતંત્રતાનો સાચો લાભ ત્યારે જ મળે, જ્યારે આપણે દરેક ક્ષેત્રમાં વિકાસની પૂરતી વ્યવસ્થા કરીએ. આ દિશામાં કેટલાક પ્રયત્નો થઈ રહ્યા છે તે આનંદની વાત છે. આવશ્યકતા એ વાતની છે કે ઔદ્યોગિક વિકાસથી ખૂબ સારી સારી વસ્તુઓનું ઉત્પાદન થવા લાગે, ખેતીમાં વિકાસ થાય, પેદાશ વધે, સ્વાસ્થ્ય તથા આરોગ્યના સાધનો વધે, વૈજ્ઞાનિકો નવી શોધખોળોમાં ભાગ લે. સાથેસાથે એક વાત પણ જરૂરી છે અને તે છે - રાષ્ટ્રના ચારિત્ર્યિક ઉત્થાનની. ભૌતિક સમૃદ્ધિની સાથેસાથે નૈતિકતાનું અવલંબન લેવામાં ન આવે તો આવી સ્થિતિ આપણા માટે વિનાશનું કારણ બની શકે છે. વ્યક્તિઓથી જ સમાજ બને છે. જે સમાજના લોકો પરિશ્રમી, પ્રામાણિક, સત્યનિષ્ઠ તથા આદર્શપ્રિય હશે, તે આપમેળે વિકસિત થશે અને રાષ્ટ્રના વિકાસનું વાતાવરણ તૈયાર થતું જશે. "સમાજ તથા રાષ્ટ્રના હિતમાં જ વ્યક્તિનું હિત સમાયેલું છે." સમાજશાસ્ત્રનો આ સિદ્ધાંત સો ટકા સાચો છે, પરંતુ વ્યક્તિગત સ્વાર્થ સામે સામૂહિક તથા રાષ્ટ્રીય હિતોને ન્યોછાવર કરી દેનાર સમાજનું અધઃપતન સુનિશ્ચિત છે એ પણ એટલું જ સાચું છે. જ્યાં સહાનુભૂતિપૂર્ણ હૃદયોની ગંગા વહી રહી હોય, ત્યાંના સમાજ કે રાષ્ટ્રનું માનવજીવન ક્યારેય વેરાન ન બની શકે. પ્રેમ અને દયાના ઉચ્ચસ્તરીય વાતાવરણમાં રાષ્ટ્ર ફૂલેફાલે છે. આપણા માટે તો એ સમય ઈતિહાસ છે. ભારતનો ભૂતકાળ સૌજન્યતા, દયા તથા પ્રેમની પ્રતિકૃતિ સમો રહ્યો છે. આનાથી તો તેનું રાષ્ટ્રીય જીવન ખુશાલીપૂર્ણ રહ્યું છે. આજની પરિસ્થિતિઓમાં પહેલાં હતી તેવી શક્તિઓનું અવતરણ ફરીથી સંભવ છે અને વિકાસ તથા વિશ્વ શાંતિ માટે આજે તેની સર્વોચ્ચ આવશ્યકતા છે.

સનાતની શંખનાદ

■ ઈશ્વરભાઈ કરણાવત બાલાઘાટ

દોહા

બિગુલ વાગ્યું સનાતનનું... ગગન ગુંજ્યો જયકારો થી
શ્વેત-પત્રથી સજગ થયો... હર સનાતની લલકારોથી
એક વાત કરવી છે મારે... સનાતની સરદારોથી
જન-શક્તિ છે સંગ તમારે... ટક્કર લ્યો પડકારોથી
કહેવી છે એક વાત મને... આજે મા ઉમિયાના સંતાનોને
સનાતની સમજો પોતાને... સનાતન ધર્મ અપનાવો ને
કહેવી છે એક વાત મને...

ઈમામ શા.ની તિલસ્મી યુક્તિએ... ભરમાવ્યા પાટીદારોને
પાખંડી પ્રપંચો દ્વારા... લલચાવ્યા પાટીદારોને
અજ્ઞાનતાનો લાભ ઉઠાવી... મુમના બનાવ્યા પાટીદારોને
એકની પાછળ આવ્યા અનેકો... વટલાવ્યા પાટીદારોને
કેશરા પરમેશ્વરાએ... સમજાવ્યા ખાનાઈઓને
સનાતની સમજો પોતાને...

નારાણ રામજી પોતે જાગ્યા... સૂતેલાને જાગ્રત કર્યા
રતનશી ખીમજીએ બીડું ઝડપ્યું... લડવૈયા તૈયાર કર્યા
ઘડવૈયાની કુશલ કરામત... ધરમ ધજા છે ફરકતી ગઈ
સનાતની હુંકારની સામે... સૈયદોની ઊંઘ હરામ થઈ
સ્વાભિમાનનું ચાલ્યું સુદર્શન... પાઠ ભણાવવા વિધર્મીઓને
સનાતની સમજો પોતાને...

ઈમામશાને સદ્‌ગુરુ માને... મા ઉમિયાની પૂજા કરે
જાણીને પણ સમજે નહીં... જ્ઞાતિને કલંકિત કરે
સમય સમય પર ધર્મનામ બદલે... વૈદિક ધર્મ ન હોઈ શકે
ટંગડી પોતાની ઊંચી રાખે... એ હિન્દુ કદી હોઈ ન શકે.
ધનના ઢગલાની લાલચ છોડી... ત્યાગો હવે પિરાણાને
સનાતની સમજો પોતાને...

કહેવી છે એક વાત મને... આજે મા ઉમિયાની સંતાનોને
સનાતની સમજો પોતાને... સનાતન ધર્મ અપનાવોને
કહેવી છે એક વાત મને...



realpatidar.com

https://archive.org/details/bk1393/page/n14/mode/1up

PATIDAR SAURABH (Monthly)
Regd. No. GKCH / 88-A / 2009-2011
RNI No. GUJGUJ / 2001 / 6356

realpatidar.com



realpatidar.com

Printed, Published and owned by Neeta Patel and printed at Allied Offset, Gomtipur - Ahmmedabad and Published at Nakhatrana (Kachchh). Editor : C.K. Patel.
Sweta Offset Pvt. Ltd. Ph. : 22940375